

MAIL/CS/NEWSPAPER/2024/ August 23, 2024 Τo, To, The Secretary, Asst. Vice President, National Stock Exchange of India Ltd., BSE Ltd. 25<sup>th</sup> Floor, Exchange Plaza, Plot C/1, G Block Phiroze Jeejeebhoy Towers, Bandra-Kurla Complex, Dalal Street, Fort, Bandra (E), Mumbai - 400 001 Mumbai - 400 051 Scrip Code - 520059 Scrip Code - MUNJALAU

# Sub: Publication of notice in newspaper pertaining to transfer of shares to Investors Education and Protection Fund (IEPF)

Dear Sirs,


Pursuant to clause (a) of Rule 6 (3) of Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, we would like to inform that the final notice informing Equity Shareholders of the Company regarding transfer of shares to Investor Education and Protection Fund (IEPF), has been published in The Business Standard, Ahmedabad Edition in English language and Loksatta-Jansatta, Vadodara Edition in Gujarati language on Friday, August 23, 2024.

This is submitted for your information and records.

Thanking you,

For Munjal Auto Industries Limited

Gauri Y Bapat Company Secretary ACS 22782



Instruction for Remote e-voting prior to the AGM and Remote e-voting during the AGM

Pursuant to Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and the Secretarial Standards on General Meeting ("SS-2") issued by the Institute of Company Secretaries of India, the Company is providing facility to all its Members to cast their vote on all the resolutions to be set forth in the Notice of the AGM by electronic means (evoting) by using electronic voting system provided by the NSDL either by (a) remote e-voting prior to the AGM or (b) e-voting during the AGM.

Only a person, whose name is recorded in the Register of Members/Beneficial Owners as on Tuesday, September 17, 2024 (the "cut-off date") are provided with the facility to cast their vote electronically, by availing the facility of remote e-voting prior to the AGM or e-voting during the AGM as per the procedure stated in the notes to the Notice of the AGM on all the resolutions to be set forth in the Notice

note that subsequent to such transfer of relevant shares to IEPF, all future benefits which may accrue thereunder, including future dividends, if any, will be credited to IEPF.

Shareholders may note that both the unpaid/unclaimed dividends and the shares transferred to IEPF Bank/Demat Account including all benefits accruing on such shares, if any, may be claimed by them from IEPF Authority after following the procedure prescribed under the Rules. Please note that no claim shall lie against the Company in respect of unclaimed dividend amount and shares transferred to IEPF pursuant to the rules.

The concerned shareholders, holding shares in physical form and whose shares are liable to be transferred to IEPF, may note that the Company would be issuing new share certificate(s) in lieu of the original share certificate(s) held by them for the purpose of transfer of shares to IEPF as per Rules and upon such issue, the original share certificate(s) which stand registered in their name will be deemed cancelled and non-negotiable. In case the shareholders have any gueries on the subject matter and the Rules, they may contact the Company's Registrar and Transfer Agent at M/s. MCS Share Transfer Agent Ltd, 1st Floor, Neelam Apartment, 88, Sampatrao Colony, Above Chappanbhog sweets, Alkapuri, Vadodara - 390007, Tel. No. (0265) 2314757 / 2350490, E-mail: mcsltdbaroda@gmail.com.

Management, warmly welcomed incoming event to create a friendly atmosphere and students and enlightened them about the academic and extracurricular opportunities M Patel, Chairman SVKM and President available. Prestigious Alumni Mr Krupesh Patel, Mr Ankur Raj Yadav, Mr Randeep Chhabra, Mr Dhen Gupta from Coca-Cola, Housing.com, 3M, Intas-Pharmaceuticals

positive tone for students. Shri Vallabhbhai Kadi congratulated team SKPIMCS-MBA for organising a successful event.

### Campus reporters: Tirth and Ayushi



he AGM are given below and shall also be provided in the Notice of the AGM. Members attending through VC DAVM shall be counted for the purpose of reckoning the guorum under section 103 of the Companies Act. 2013

Important Note for shareholders holding shares in physical form

1) Please update your KYC details (PAN, AADHAR, etc.) & Bank details by writing to Company's RTA, if already not done.

2) Please dematerialize your shares held in physical form.

For Mun	jal Auto Industries Limited
	Sd/-
	Gauri Y Bapat
Place : Waghodia, Vadodara	Company Secretary
Date : August 22, 2024	ACS22782

provided the significance entrepreneurship, leadership and time-management skills. Faculties highlighted the institution's values, campus

respectively conducted expert sessions that

### **CAMPUS TO CORPORATE TALK SESSION @ SKIPS**

How to Plan a Career and a Balanced Life on the Path of Least Resistance' was encouraged to look for the bigger picture the subject of the Campus to Corporate beyond the demands of society. Society has Guest Talk by Mr Nirav Shah, Entrepreneur created a façade that life is tough, according and TEDx Speaker at SKIPS School of to the speaker. His mantra for success to the Business. Mr Shah started the energetic and students was- 'Life is beautiful and can be highly interactive session by setting the balanced for it to be stress-free'. mood with some practical inputs from his roller-coaster ride to success. He advised the young management aspirants to explore their talents and strive for a happy life beyond degrees. The speaker's contagious

energy rubbed off the young minds who were



			cial Assets an est (Enforcem	r/w 9(1)] F IMMOVABLE PROPER d Enforcement of Secur ent) Rules, 2002.	ity Interest A		, .			.,
puro rec	chase of the secured prop ourse Basis" for recovery	sind Bank Limited. The Authorized Officer of Indusind Bank Limited hereby intends t erty The property shall be sold in exercise of rights and powers under the provision y of amount shown below in respective column due to Indusind Bank Limited as Se r, Outstanding Dues, Date of Demand Notice sent under Section 13(2), Possession D	ns of sections 1 cured Creditor	3 (2) and (4) of SARFAE	SI Áct; on " <b>A</b> r, Guarantors	s is where is & Mortgagor	", "As is what is' 's as shown below	", and "Whatever v. Details of the B	r there is" orrower(s)	and "Withou , Guarantors
Sr. No.	Name of Borrower(s)/ Guarantors/ Mortgagors	Details of the Secured Asset	Owner of the property	Outstanding Dues as on 21.08.2024 (IN INR)		Possession Date	Reserve Price (IN INR)	Bid Increment Amount (IN INR)	EMD (IN INR)	Date & Time of Inspectio
1.	M/s. Dhanlaxmi Plastic Industries (Borrower) Mrs Vaishali Panchal (Guarantor) Mr Manan Panchal (Guarantor/Mortgag or)	Lot No 1: All That The Pieces And Parcel Of Immoveable Property Comprising O Shop No 106 On 1st Floor, Adm 32-16-49 Sq Mtrs Build Up Construction And Adm 10.03 Sq Mtrs Undivided Land Share (As Per Sale Deed No 1153/2021) In The Scheme Know As Shree Kham Divine Commercial Complex Situated At Block Nc 941/B Paiki Of Mouje : Khatraj Taluka Mahemdabad And District Kheda 382330 Lot No 2: All That The Pieces And Parcel Of Immoveable Property Comprising O Shop No 107 On 1st Floor, Adm 30-08-53 Sq Mtrs Build Up Construction And Adm 9.38 Sq Mtrs Undivided Land Share (As Per Sale Deed No 1154/2021) In The Scheme Know As Shree Kham Divine Commercial Complex Situated At Block No 941/B Paiki Of Mouje : Khatraj Taluka Mahemdabad And District Kheda 382330 Lot No 3: All That The Pieces And Parcel Of Immoveable Property Comprising O Shop No 109 On 1st Floor, Adm 40-20-60 Sq Mtrs Build Up Construction And Adm 12.54 Sq Mtrs Undivided Land Share (As Per Sale Deed No 1156/2021) In The Scheme Know As Shree Kham Divine Commercial Complex Situated At Block No 941/B Paiki Of Mouje : Khatraj Taluka Mahemdabad And District Kheda 382330	Manan Panchal	Rs. 79.70 Lakhs		09.01.2024	Lot No 1 Rs 13.70 Lakhs Lot No 2 Rs 12.80 Lakhs Lot No 3 Rs 17.00 Lakhs	Lot No 3 Rs 25000/-	Lot No 1 Rs 1.37 Lakhs Lot No 2 Rs 1.28 Lakhs Lot No 3 Rs 1.70 Lakhs	05.09.202 11.00pm 05.09.202 11.00pm 05.09.202 11.00pm 05.09.202 11.00pm 1.00pm
Date		t No: 00013564604005, Name of the Beneficiary: Sundy Deposit Asset MGT 2.09.2024 Lot No 1 11.00 am to 12.00 pm   12.09.2024 Lot No 2 12.00 pm to 1.			,	)pera House	Mumbai, IFSC	Code: INDB0000	001	
L <b>ast</b> For (	date and time for subm detailed terms and condition notice is also a mandator	2.09.2024 Lot NO 1 11.00 am to 12.00 pm 12.09.2024 Lot NO 2 12.00 pm to 1. ission of bid letter of participation/KYC Document/Proof of EMD:- 11.09.2024 ti ons of the sale, please refer to the link provided in Secured Creditor's website i.e. ww STATUTORY NOTICE FOR SALE UNDER Rule 8(6) ro y notice of not less than 15 (Fifteen) days to the Borrower(s) of the above loan acco nent of Security Interest Act, 2002, informing them about holding of auction/sale throu	I 4.00 pm w.IndusInd.co /w 9(1) OF SEC	m or https://sarfaesi.auc CURITY INTEREST (ENF 8(6) r/w 9(1), of Security	tiontiger.net ORCEMENT)	RULES, 200	2			econstruction

- The remote e-voting period will commence at 09:00 a.m. (IST) on Saturday. September 21, 2024 and will end at 05:00 p.m. (IST) on Monday, September 23, 2024. During this period, Members may cast their vote electronically. Remote e-voting shall be disabled by NSDL after 05:00 p.m. on Monday, September 23, 2024 and Members will not be allowed to vote through remote e-voting thereafter. Once the vote on resolutions is cast by the Members, the Member shall not be allowed to change it subsequently. The evoting module during the AGM shall be disabled by NSDL for voting 15 minutes after the conclusion of the Meeting.
- The Members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend/participate in the AGM through VC/OCVM but shall not be entitled to cast their vote again
- Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after dispatch of the Notice and holding shares as of the cut-off date, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.com. However, if a person is already registered with NSDL for remote e-voting then he/she can use his/her existing login id and password, and cast his/her vote.
- Members are requested to read all the notes set out in the Notice of the AGM and instructions for participating at the AGM and manner of casting vote through remote e-voting or through e-voting during the AGM. This notice is issued for the benefit of all the Members of the Company in compliance with the applicable MCA and SEBI circulars.

As per the MCA Circulars and SEBI Circular, no physical copies of the Notice of the AGM and Annual Report will be sent to Members. Members who have not registered their email address are requested to follow the process mentioned below for registering their e-Mail addresses to receive the Notice of AGM and Annual Report electronically and to receive login ID and password for e-voting.

The Company has made special arrangement with the RTA for registration of e-mail addresses in terms o the MCA Circulars for Members who wish to receive the Annual Report along with the AGM Notice electronically and to cast the vote electronically. In order to register the email id for receiving the Notice of 31st AGM and Annual Report through email please Email at rnt.helpdesk@linkintime.co.in and provide the requisite information and attach requisite documents. The system will then confirm the e-mail address for the limited purpose of servicing the Notice of this AGM along with the Annual Report for the year 2023-24.

It is clarified that, to receive timely communications from the Company, please permanently register/update your e-mail address and for registration please contact R&TA/respective Depository Participant, as the case may be.

In case of any queries/grievances pertaining to remote e-voting (prior to and/or during the AGM) you may refer to the Frequently Asked Questions ('FAQs') for Shareholders and e-voting user manual for Shareholder available in the 'Downloads' section of www.evoting.nsdl.com or call on 022 - 4886 7000 and 022 - 2499 7000 or send a request to Ms. Prajakta Pawle at evoting@nsdl.com.

### Manner of registering mandate of receiving dividend:

- In respect of the Members holding shares in electronic form, the bank details obtained from the respective depositories will be used for the purpose of distribution of dividend through various approved/ permissible electronic mode of payment. The Company/ R&TA cannot act on any direct request from the Members holding shares in dematerialized form for update/ change of such bank details. Such changes are to be intimated by the Members to their depository participants.
- In respect of the Members holding shares in the physical form, the bank details obtained from the R&TA will be used for the purpose of distribution of dividend through various approved/ permissible electronic mode of payment. The facility for registration of bank details for the Shareholders holding shares in physical form are also available on Email: mt.helpdesk@linkintime.co.in by providing details sought at the earliest so that it could receive by the Company before making the payment of dividend.

In accordance with the provisions of the Income Tax Act, 1961 ('Act') as amended by and read with the provisions of the Finance Act, 2020, applicable with effect from April 01, 2020, dividend declared and paid by the Company is taxable in the hands of its shareholders, and accordingly the Company is required to deduct tax at source (TDS) at the applicable rates. The shareholders have an option to apply to the Company for non-deduction of TDS or deduction of TDS at a lower rate by providing the necessary documents. Please click on link at <u>https://liiplweb.linkintime.co.in/client-downloads.html</u> and use "General Tab" for downloading Form 15G/15H/10F for current financial year.

Please click on link\_at https://liiplweb.linkintime.co.in/formsreg/submission-of-form-15g-15h.html for submission of Form 15G/15H/10F for current financial year for non deduction of TDS on Dividend declared by the Company.

Any guery related to dividend or any request regarding change/ update in the address or bank details should be directed to R&TA at Email: rnt.helpdesk@linkintime.co.in, Contact No.: 8108116767.

Payment of dividend shall be made through electronic mode to the shareholders who have updated their bank account details. In case the Company is unable to pay the dividend to any shareholder by electronic mode due to non-availability of the details of the bank account, the Company shall dispatch the dividend warran cheque to such shareholder by post. 

	For Vidhi Specialty Food Ingredients Limited
	Sd/-
Place: Mumbai	Vishakha Pandya
Date: August 22, 2024	Company Secretary
-	Membership No. A59436

# શુંસ્વાર ર૩ ઓગસ્ટ, ૨૦૨૪

# અર્શકારણ

# **લોક सता 🖗 જન सता** <u>बजेहरा</u>

<mark>કોમોડિટી વાચદાઓમાં રૂા.૮૪૧૧ કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂા.૩૪૯૬૩.૬૩ કરોડનું ટર્નઓવર</mark> દેશનો આર્થિકવૃદ્ધિદર આગામીબેવર્ષ

# સોનાના ભાવમાં રૂા. ૯૯ અને ચાંદીમાં રૂા. ૩૮૯નો સુધારો

રૂ.૭૧૭૫૧ના સ્તરને સ્પર્શી, રૂ.૭૧૭૭૭ના આગલા બંધ સામે રૂ.૩૮૯ વધી રૂ.૮૫૧૧૯ના સ્તરે થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની વધી રૂ.પ૭૭૨૭ના સ્તરે પહોંચ્યો

# મુંબઈ, તા.૨૨

રૂ.૪૩૩૭૫.૪૪ કરોડનું ટર્નઓવર સોના-ચાંદીના

ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન દેશના અગ્રણી કોમોડિટી ઈન્ડેક્સ બુલડેક્સ ઓગસ્ટ વાયદો ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ ૧૮૦૩૦ પોઈન્ટના સ્તરે પહોંચ્યો પર વિવિધ કોમોડિટી વાયદા, હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં પ્રીમિયમ ટર્નઓવર રૂ.૬૪૮.૦૭

MI M

રૂં.૯૯ વધી રૂ.૭૧૮૭૬ના ભાવ પહોંચ્યો હતો. આ સામે કિલોદીઠ ૪૦ પૈસા વધી રૂ.૧૮૯.૩૫ના ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ. ૩૮૫ ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એનર્જી ઓગસ્ટ વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૭૯ વધી રૂ.૮૪૯૧૦ના સ્તરે પહોંચ્યો સેગમેન્ટમાં રૂ.૧૪૦૭.૫૩ કરોડનાં હતો. જ્યારે ચાંદી-માઈક્રો ઓગસ્ટ કામકાજ થયાં હતાં. એમસીએક્સ હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ઓગસ્ટ વાયદો રૂ.૩૮૧ વધી રૂ.૮૪૯૦૩ના ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૧૦ વધી સ્તરે પહોંચ્યો હતો. બિનલોહ રૂ.૬૧૨૭ના ભાવે ખૂલી, રૂ.૭૦૧૯ના સ્તરે પહોંચ્યો હતો. ધાતુઓમાં રૂ.૧૯૩૯.૨૧ કરોડનાં ઉપરમાં રૂ.૬૧૯૭ અને નીચામાં સાંજે પાંચ વાગ્યા <sup>ે</sup>સુધીમાં કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોનું-મિની સપ્ટેમ્બર વાયદો ૧૦ કામૅકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ રૂ.૬૧૨૭ના મથાળે અથડાઈ, વાયદાઓમાં ગ્રામદીઠ રૂ.૯૪ વધી રૂ.૭૧૪ ૩૪ના ઓગસ્ટ વાયદો રૂ.૪.૮૫ વર્ધી રૂ.૬૧૫૪ના આગલા બંધ સામે નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.૫૦૩૯.૬૧ કરોડનાં કામકાજ ભાવ થયા હતા. યાંદીના રૂ.૮૦૪.૮ના સ્તરે પહોંચ્યો હતો. રૂ.૧૮વધી રૂ.૬૧૭૨ના ભાવ થયા રૂ.૮૪૧૧ કરોડનાં કામકાજ થયાં થયાં હતાં. એમસીએક્સ સોનું વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો જ્યારે જસત ઓગસ્ટ વાયદો રૂ.૩ હતા. જ્યારે ક્રૂંડ તેલ-મિની સપ્ટેમ્બર હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ કિલોદીઠ રૂ.૮૪૭૮૦ના ભાવે ખૂલી, વધી રૂ.૨૬૭.૬ના સ્તરે પહોંચ્યો વાયદો રૂ.૧૯વધી રૂ.૬૧૭૯ના સ્તરે રૂ.૩૪૯૬૩.૬૩ કરોડનું નોશનલ રૂ.૭૧૮૫૭ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૮૫૧૯૦ અને નીચામાં હતો. આ સામે એલ્યુમિનિયમ પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ

ટ્રેડિંગમાં કંપનીનો શેર સીધો ૧૩ ગ્રાહકોને વેલ્યૂ જોઈએ છે અને તેઓ

ટકા વધી ગયો હતો. ટાર્ગેટને પ્રાઈસ માત્ર આવશ્યક ચીજો પર જ ફોકસ

કટનો ફાયદો મળ્યો છે. કંપનીએ કરે છે. તેઓ ઓછી મહત્ત્વની ચીજો

વધુને વધુ ગ્રાહકોને આકર્ષવા પર સમજી વિચારીને ખર્ચ કરે છે.

માટે સૌથી વધુ વેચાતી ૫૦૦૦ જોકે, વર્ષના બાકીના મહિનાઓમાં

MADHYA GUJARAT VIJ COMPANY LIMITED

O&M CIRCLE OFFICE, GOTRI ROAD, BARODA-390 021 Tel : 2355520/21 Fax 2313164

barodaom@gebmail.com - E&P Dept-GoG: http://guj-epd.gov.in CIN U40102GJ2003SGC042907

રૂં.૮૪૭૩૦ના આગલા બંધ સામે રૂ.૨૨૬.૫૫ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ઓગસ્ટ વાયદો

અત્યારથી સાવધ છે.

🕼 बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda

ઉપરમાં રૂ.૭૨૦૯૯ અને નીચામાં ૨.૮૪૭૮૦ના મથાળે અથડાઈ, ઓગસ્ટ વાયદો કોઈ ફેરફાર વગર આંગસ્ટ વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.ર વધી રૂ.૧૮૬.૧ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો રૂ.૨.૧ વધી રૂ.૧૮૬.૧ના ભાવે બોલાયો હતો. કૃષિચીજોમાં મેન્થા તેલ ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ.૯૬૪.૯ના ભાવે ખૂલી, ૭૦ પૈસા વધી રૂ.૯૬ ૩.૭ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.પ૦ વધી રૂ.૫૭૧૦૦ના ભાવ થયા હતા. કામકાંજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.૨૭૫૯.૧૫ કરોડ અને ચાંદીના

વિવિધ વાયદાઓમાં રૂ.૨૨૮૦.૪૬ કરોડના વેપાર થયા હતા.

કરશે. જેમાં દેશની સૌથી મૂલ્યવાન ભારતીય કેંપનીઓના મૂડીખર્ચમાં કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જ કુલ ઓઇલ એન્ડ ગેસ સેક્ટરેની સાત ખર્ચના લગભગ 30% ખર્ચ કરશે. તે ઉપરાંત નેટ ઝીરો ટાર્ગેટને હાંસલ આસપાસ રહેશે. આ કંપનીઓ તેની કરવા માટે પણ વધુ ખર્ચ કરવામાં ક્ષમતાનું વિસ્તરણ કરવા તેમજ નેટ આવશે તેવું મૂડીઝ રેટિંગ્સે તેના ઝીરોના લક્ષ્યને હાંસલ કરવા માટે રિપોર્ટમાં જણાવ્યું છે. મૂડીઝ રેટિંગ્સ અંદાજે \$15 અબજનો વાર્ષિક ખર્ચ અનુસાર રેટેડ ભારતીય કંપનીઓનો કરશે. ઉદાહરણ તરીકે આગામી બે મૂડીંખર્ચ આગામી એકથી બે વર્ષ વર્ષ દરમિયાન રિઝર્વમાં વધારો, દરમિયાન \$45-50 અબજની ઇન્ટિગ્રેશન તેમજ ઉર્જાને લગતા આસપાસ રહેશે. અનેકવિધ બિઝનેસ લક્ષ્યો હાંસલ કરવા માટે ઓઇલ સેગમેન્ટમાં વાર્ષિક \$15 અબજના એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન બજેટ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો લિમિટેડ (Baa 3 સ્ટેબલ) અને પોર્ટફોલિયો મૂડીખર્ચમાં 30% હિસ્સો રહેશે. આગામી કેટલાક અને \$4 અબજનો ખર્ચ કરશે.

નવી દિલ્હી. તા.૨૨

દરમિયાન ૬%ના દરે વધવાની શક્યતા વર્ષ દરમિયાન દેશની રેટેડ ભારતીય કંપનીઓ તેની ક્ષમતાનું કંપનીઓ દ્વારા ખર્ચમાં ઓઇલ વિસ્તરણ કરવાના આશય સાર્થે એન્ડ ગેસ સેક્ટર તેમજ રિલાયન્સ આગામી 1-2 વર્ષમાં વાર્ષિક \$45- ઇન્ડસ્ટ્રીઝનો હિસ્સો 60% રહેશે. 50 અબજ (4 લાખ કરોડ)નું રોકાણ મૂડીઝ અનુસાર દેશની કુલ રેટેડ રેટેડ કંપનીઓનો હિસ્સો 30%ની ઇન્ડિયન ઓઇલ અનુક્રમે \$6 અબજ



# યુએસમાં કસ્ટમર્સ વ્યાજદર અને અને ક્રુગાવાથી પરેશાન છે. અમેરિકનો હાલમાં ટાર્ગેટ અને ચીજવસ્તુઓના ભાવમાં કાપ મૂક્યો વેચાણ કેટલું વધશે અને નફામાં વોલમાર્ટ જેવી ડિસ્કાઉન્ટ ચેઈન્સ પર છે. આ સ્ટ્રેટેજી ફળદાયી રહી છે અને વધારે ખરીદી કરી રહ્યા છે. ટાર્ગેટના છેલ્લા ક્વાર્ટરમાં ટાર્ગેટની મુલાકાતે સ્ટોર પર છેલ્લા એક ક્વાર્ટરમાં આવતા કન્ઝ્યુમરની સંખ્યા ૩ ટકા સેલ્સમાં બે ટકાનો વધારો થયો છે વધી છે. હાલમાં ટાર્ગેટના ગ્રાહકો જ્યારે કંપનીનો નકો ૩૬ ટકા વધ્યો કલોથિંગ પાછળ પણ ભારે ખર્ચ કરી છે. પરિણામે ગઈકાલે પ્રિ માર્કેટ રહ્યા છે. એનાલિસ્ટ્સનું કહેવું છે કે

## નવી દિલ્હી, તા.૨૨

સ્ટોરમાં ગયા ક્વાર્ટરમાં ખરીદીમાં અમેરિકન ગ્રાહકો મોંઘવારી ૪.૨ ટકાનો વધારો થયો હતો. અને ઊંચા વ્યાજદરથી પરેશાન અમેરિકાના લોકો છેલ્લા કેટલાય છે જેના કારણે આવશ્યક ચીજો જ વર્ષોથી દરેક ચીજવસ્તુના ઊંચા ભાવ ખરીદે છે. ટાર્ગેટ અને વોલમાર્ટે તેની અને ઊંચા વ્યાજના દરથી ત્રાસી ગયા કેટલીક ચીજોના ભાવમાં મોટો કાપ છે, પરંતુ હવે તેમને થોડી રાહત મૂક્યો તેનાથી ગ્રાહકોને ફાયદો થયો મળી છે. કેટલીક રિટેલ ચેઈને ભાવ



• E Mail : cs@munjalauto.com • Website : www.munjalauto.com <b>લોટીસ</b> (કંપનીના ઇક્પિટી શેરધારકોના ધ્યાન માટે) વિષય: રોકાણકાર શિક્ષણ અને સંરક્ષણ ભંડોળ (IEPF) માં કંપનીના ઇક્પિટી શેરના ટ્રાન્સફર આ નોટિસ રોકાણકાર શિક્ષણ અને સંરક્ષણ ભંડોળ ઓથોરિટી (એકાઉન્ટિંગ, ઓડિટ, ટ્રાન્સફમ અને રિફંડ) નિથમો ૨૦૧૬ ('નિથમો'), અને સમય સમય પર તેમા કરવામાં આવેલા સુધારો સાથેની જોગવાઈઓ અનુસાર પ્રકાશિત કરવામાં આવી છે.	રેન્દ્રસ વેં ગ્રેમ્ડ રુકિયા Central Bank of India ઓથી નીચે સહી કરનાર સેન્દ્રલ બેંક ઑફ ઇન્ડિયા, રેસકોર્સ શાખા ના અધિકૃત અધિ કાયનાન્સીયલ એસેટસ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હે ૨૦૦૨ ના રૂલ્સ 3 સાથે વાંચતા સેક્શન ૧૩(૨) અને ૧૩(૧૨) હેઠળ પ્રાપ્ત થયેલ સતાની શ્રી આથુપચંદ્રકાંત મિસ્ત્રી ને ડીમાન્ટ નોટીસ તાઃ ૦૧.૦૫.૨૦૨૪ ના રોજ પાઠવીને નં રૂ. ચૌદ લાખ સાતસો ઓગણત્રીસ અને પૈસા વીસ પુરા) (જે ૨૯.૦૨.૨૦૨૪ ના રોજના ગર્જના અને અન્ય ખર્ચ તા ૨૯.૦૨.૨૦૨૪ થી આજની તારીખ સુધી આ નોટિસ મળ્યાની તારી	ાને દ્વર્ધ 2(૧) (નંડળ) કારીએ સિક્ચોરિટાઇઝેશન અને રીકન્સ્ટ્રકશન ઓફ ઠળ અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ રૂઇએ કરજદાર શ્રી ચંદ્રકાંત બેચરભાઈ મિસ્ત્રી અને ોટીસમાં દર્શાવેલ રકમ રૂા. ૧૪,૦૦,૭૨૯.૨૦ (એક મુદ્ધલ વત્તા વ્યાજનું પ્રતિનિધિત્વ કરે છે) પ્લસ વ્યાજ	આથી નોટિસ આપવામાં આવે છે કે નીચેના કરજદારોએ બેંક પાસેથી મેળવેલી લોનની સુવિધાના મુદ્દલ અને વ્યાજની ચુકવણીમાં ડિફોલ્ટ કરેલ દ અને લોનને નોન–પર્ફોમિંગ એસેટ્સ (NPA) તરીકે વર્ગી કૃત કરવામાં આવી છે. સરફેસી એક્ટ ૨૦૦૨ ની કલમ ૧૩(૨) હેઠળ તેમને નોટિર તેમના છેદ્દા જાણીતા સરનામાં પર જારી કરવામાં આવી હતી, પરંતુ તેઓને બિન–સેવા/ સ્વીકૃત પરત કરવામાં આવી છે અને તેથી બેંક આ જોટ સૂચના દ્વારા તેમને જાણ કરે છે. બેંકે પ્રોપર્ટી ના સરનામાં પર ચોંટાડીને ફોટોગ્રાફ્સ પણ લીધા છે. કરજદાર નું નામ ઈક્વિયેબલ મોર્ટગેજ પ્રોપર્ટીનો તે તમામ ભાગ અને પાર્સલ નોટીસ ની એનપીએ ની બાકી સ્ક્રમ તારીખ (નોટિસની તારીખ મુજબ) શ્રીમતી વર્ષાબેન ફલેટ નં. ૩૦૧, ૩જો માળ, શ્રીજી કોમ્પ્લેસ, ભાગ્યોદય ભરતભાઈ કોમ્પ્લેસ પાસે, દંતેશ્વર, વડોદરા. ચર્તુસીમા: પૂર્વ: દાદર (રૂપિયા અઢાર લાખ અઢાર							
નિયમો અનુસાર, એવા તમામ શેરધારકો કે જેમના દ્વારા સતત સાત વર્ષ કે તેથી વધુ સમય સુધી ડિવિડન્ડનો દાવો ન કર્યો હોય તેમના શેર રોકાણકાર શિક્ષણ અને સંરક્ષણ ભંડોળ (IEPF) માં ટ્રાન્સફર કરવા માટેની જોગવાઈઓ ધરાવે છે. નિયમોમાં નિર્ધારિત વિવિધ આવશ્ચકતાઓ અનુસાર, જેમના શેર રોકાણકાર શિક્ષણ અને ભંડોળ (IEPF) માં ટ્રાન્સફર કરવા માટે જવાબદાર છે તેવા તમામ સંબંધિત શેરધારકોને કંપનીએ તેમના નોંધાયેલા સરનામે ઓગસ્ટ ૨૨, ૨૦૨૪ ના રોજ રિમાઈન્ડર પત્ર દ્વારા નોટિસ મોકલી આપેલ છે.	આવેલ છે. કરજદારો રકમ ચુકતે કરવામાં નિષ્ફળ ગયા હોય, આથી કરજદારો, જામીનદાર અને જાહેર સહી કરનારે ઉપરોક્ત અધિનીયમના ઠરાવ ૮ સીક્યુરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્ર તેને/તેણીને પ્રાપ્ત અધિકારોની રૂઇએ નીચે દર્શાવેલ વિસ્તૃત મુજબ મિલકતનો <b>કબજો તા</b> ર કરજદારો અને જામીનદાર તથા જાહેર જનતાને સદર મિલ્કત સંદર્ભે કોઇપણ પ્રકારનો વ્યવ કોઇ પણ વ્યવહાર કરશો તો સદર વ્યવહાર <b>સેન્દ્રલ બેંક ઑફ ઇન્ડિયા</b> ની રકમ <b>રૂા.</b> ઓ <b>ગણત્રીસ અને પૈસા વીસ પુરા</b> ) (જે ૨૯.૦૨.૨૦૨૪ ના રોજના મુદ્દલ વત્તા વ્યાજનું પ્ર થી તેના પરના વ્યાજ અને અન્ય ખર્ચ.	સ ૨૦૦૨ સાથે વાંચતા સેક્શન ૧૩(૪) ની અન્વચે દીખ: ૧૭.૦૮.૨૦૨૪ ના રોજ લઇ લીધેલ છે. વહાર ન કરવા ચેતવણી આપવામાં આવે છે તેમજ જો ૧૪,૦૦,૭૨૯.૨૦ (એકે રૂા. ચૌદ લાખ સાતસો તિનિધિત્વ કરે છે) પ્લસ તા. ૨૯.૦૨.૨૦૨૪ ના રોજ	પ્રાયમાં અઢાર લાગ ગઢાર સોલંકી (મૃત્યુકાળથી) અંગે ફલેટ નં. ૩૦૨, પશ્ચિમઃ પાર્કિંગ નો રસ્તોં, ઉત્તર: (મૃત્યુકાળથી) અંગે ફલેટ નં. ૩૦૨, પશ્ચિમઃ પાર્કિંગ નો રસ્તોં, ઉત્તર: (મૃત્યુકાળથી) અંગે ફલેટ નં. ૩૦૨, પશ્ચિમઃ પાર્કિંગ નો રસ્તોં, ઉત્તર: (મૃત્યુકાળથી) અંગે ફલેટ નં. ૩૦૨, પશ્ચિમઃ પાર્કિંગ નો રસ્તોં, ઉત્તર: (મૃત્યુકાળથી) અંગે ફલેટ નં. ૩૦૨, પશ્ચિમઃ પાર્કિંગ નો રસ્તોં, ઉત્તર: (મૃત્યુકાળથી) અંગે ફલેટ નં. ૩૦૨, પશ્ચિમઃ પાર્કિંગ નો રસ્તોં, ઉત્તર: (મૃત્યુકાળથી) અંગે ફલેટ નં. ૩૦૨, પશ્ચિમઃ પાર્કિંગ નો રસ્તોં, ઉત્તર: (મૃત્યુકાળથી) અંગે ફલેટ નં. ૩૦૨, પશ્ચિમઃ પાર્કિંગ નો રસ્તોં, ઉત્તર: (મૃત્યુકાળથી) અંગે ફલેટ નં. ૩૦૨, પશ્ચિમઃ પાર્કિંગ નો રસ્તોં, ઉત્તર: પ્રકાશનની તારીખથી ૬૦ દિવસની અંદર બાકી રક્ષ્મની ચૂક્લણી કરવા માટે આદવાન કરવામાં આવે છે, જે તેમાં નિષ્ફળતા ૬૦ ની સમાપ્તિ પછી આગળનાં પગલાં લેવામાં આવશે. સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ડ સેન્સ્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ની કલમ ૧૩ની પેટા–કલમ(૪) કેઠળ આ નોટિસની તારીખથી દિવસો.							
જેમના શેર IEPF ઓથોરિટીના ખાતામાં ટ્રાન્સફર થવા માટે જવાબદાર છે, કંપનીએ એવા શેરધારકોની સંપૂર્ણ વિગતો તેની વેબસાઈ <u>https://www.munjalauto.com/finance/unclaimed-dividend</u> અપલોડ કરી છે જેના પરથી દાવો ન કરેલા ડિવિડન્ડ અને શેર કે જે IEPF ઓથોરિટીના ખાતામાં ટ્રાન્સફર કરવા માટે જવાબદાર છે તેમની ચકાસણી કરી શકે.	સિકચોર્ક મિલકત છોડાવવા ઉપલબ્ધ સમય બાબતે ઉક્ત સરફેશી એક્ટના સેકશન (૧૩) ધ્યાન દોરવામાં આવે છે. <b>સ્થાવર મિલ્કત નું વર્ણન</b> જીલ્લો વડોદરા સબ જીલ્લો વડોદરા મોજે ગોત્રી આર.એસ. નં. ૪/૨ ટી.પી. નં. ૬૦ અને	એફ.પી. નં. ૫/ ર ક્ષેત્રફળ હકર ચોરસ મીટર જમીન	<b>રાજપીપલા નગરપાલિકા, રાજપીપલા</b> ભારત સરકારશ્રી દ્વારા તેમજ ગુજરાત સરકારશ્રી દ્વારા બહાર પાડેલ બિયમો/ઠરાવોના અમલીકરણ માટે તેમજ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છત અને નગરજનોની સ્વાસ્થ્ય અને સુખાકારી જળવાઈ રહે તે દેતુસર નીચે મુજબની વિગતે <b>રાજપીપલા નગરપાલિકા</b> દ્વારા સૂચનો બહાર પાડવામાં આવે છે. કમ સચનો સંદર્ભ નિયમો/માર્ગદર્શિકા							
ઉપરોક્ત મુદ્દાઓ ધ્યાનમાં રાખીને, આવા તમામ શેરધારકોને વિનંતી કરવામાં આવે છે કે, નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ (વચગાળાના) ના દાવો ન કરેલ ડિવિડન્ડનો દાવો કરવા માટે કંપની/રજિસ્ટ્રારને ઓગસ્ટ ૨૯, ૨૦૨૪ સુધીમાં અરજી કરવા આવે જેથી તેમના શેર IEPF માં ટ્રાન્સફર કરતા અટકાવી શકાય. મહેરબાની કરીને નોંધ કરો કે જો ઉપરોક્ત તારીખ સુધીમાં કંપની અથવા રજિસ્ટ્રાર દ્વારા કોઈ દાવો/અરજી પ્રાપ્ત ન થાય, તો કંપનીને ઉપર જણાવેલ નિયમો અંતર્ગત કોઈપણ વધુ સુચના વિના યોગ્ય પ્રક્રિયાને અનુસરીને, શેર	જે 'કૃષ્ણ રેસિડેન્સી' એપાર્ટમેન્ટ ત્રીજો માળે ફલેટ નં. ૩૦૪ સેઝફળ ૧૩૯.૩૫ ચોરસ મીટ પક.૧૦ ચોરસ મીટર. ચર્તુસીમા: પૂર્વ: ફલેટ નં. ૩૦૧, પશ્ચિમ: ૯ મીટર રોડ, ઉત્તર: ૯ મીટર લા.: ૧૭.૦૮.૨૦૨૪ -સ્થળ: વડોદરા નૉધ: વિવાદની સ્થિતિમાં આ નોટીસની અંગ્રેજી અનુવાદ માન્ય ગા ટેન્ડર નોટીસ ( જાહેર નિવિદા ૨૦૨	ર રોડ, દક્ષિણઃ ફલેટ નં. ૩૦૩. <sub>શામે,</sub> અધિકૃત અધિકારી, સેન્દ્રલ બેંક ઑફ ઇન્ડિયા ૪-૨૫)	૧.   નગરપાલિકા વિસ્તારમાં ૩૫ કિલો કરતાં વધારે કચરો ઉત્પન્ન કરતાં બલ્ક વેસ્ટ જનરેટર ઓનસાઈટ પ્રોસેસિંગ કરવા બાબત.   સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) રૂલ્સ-૨૦૧૬     ૨.   નગરપાલિકા વિસ્તારમાં ઉત્પન્ન થતાં C&D ના સંગ્રહ અને પરિવહન અને પ્રક્રિયા અને નિકાલ મોટેના વ્યવસ્થાપન નગરપાલિકા બ્રારા યુજર ચાર્જિસ લઈ કરવા બાબતેનું સ્ટ્રચન   ફોન નંબર: 02640-220763 ચાર્જિસ: 400 / ફેરાના ગાડી નં.GJ-22-G-4509							
IEPF ને ફરજીચાત ટ્રાન્સફર કરવા માટે જવાબદાર રહેશે. મહેરબાની કરીને એ પણ નોંધો કે, IEPF માં આવા શેરના ટ્રાન્સફર પછી તેમના સંબંધિત ભવિષ્યના ડિવિડન્ડ સહિત અને તેમની હેઠળ ઉપાર્જિત થઈ શકે તેવા તમામ ભાવિ લાભો જો આપવામાં આવેલા હશે તો IEPF માં જમા કરવામાં આવશે. શેરધારકો નોંધ કરે કે, IEPF ખાતામાં ટ્રાન્સફર શેર પર ના ચુકવાચેલ/દાવા	નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,વડોદરા કસ્તકની પ્રા.શાળાઓમ શાળાઓ /કચેરીના નીચેની વિગતે વાર્ષિક ઇજારા તેમજ ખરીદી અંગેના અનુભવ અને રસ ધરાવતી GST નંબર વાળી એજન્સી/સંસ્થા ક મંગાવવામાં આવે છે. જે અંગેના કોરા ટેન્ડર ફોર્મ ઉપરોકત સરનામે શકાશે. ટેન્ડર નોટીસ પ્રસિધ્ધ થયા તારીખ થી ટેન્ડર ફી રૂ.૫૦૦/-	ટેન્ડરો મંગાવવામાં આવે છે. જે તે ધંધાનો હારા નીચે જણાવેલ વિગતે ભાવ પત્રકો શી કચેરીના કામકાજના દિવસોમાં મેળવી	3. কাহখ্যাবিদ্যা বিধ্বাহমা লাখ মুখ্যজনা বহুবুআলা হায়ই, ব্যথ্যহা, ব্যাহা, কলা Amendment PWM Rules notified by MoEF&CC on August 2021   Gcruical มดิตร์เลิต ระตามส์ พid &. Amendment PWM Rules notified by MoEF&CC on August 2021   polystyrene [Thermocol] for decoration packing films around sweet boxes. (Penalty on use and littering of SUP items: Spot   invitation cards and cigarette packets earbuds with plastic ticks plastic Specific august 2021							
વગરના બંને ડિવિડન્ડ અને આવા શેરો પર ઉપાર્જિત થતા તમામ લાભો કે જે આપવામાં આવેલા હશે તો ઉપર જણાવેલ નિચમો હેઠળ નિર્ધારિત પ્રક્રિયાને અનુસર્ચા પછી IEPF ઓથોરિટી પાસેથી દાવો કરી અને મેળવી શકે છે. મહેરબાની કરીને નોંધ કરો કે, નિચમો અનુસાર IEPF માં ટ્રાન્સફર કરવામાં આવેલ દાવા વગરના ડિવિડન્ડની રકમ અને શેરના સંબંધમાં કંપની સામે કોઈ દાવો કરવામાં આવશે નહીં.	nm કે જે ulsand શકે છે. શ કરવામાં સામે કોઈ સામે કોઈ		cups, glasses, cutlery such as forks, spoons, knives, straw, trays, wrapping, stirrers plastic or PVC banners less than 100 microns, Instruction rescription of SUP items: Spot fine on institutional waste generators Rs.500/- Spot fine on institutional waste generators Rs.500/- Spot fine on institutional waste generators Rs.500/-) <b>x</b> . Ban on the use, sale, and storage of non-biodegradable plastic bags/ plastic products less than 120 microns, in compliance with Plastic Waste Management Rules 2022 Plastic Waste Management Rules 2022							
શેરધારકો કે જેઓ ભૌતિક સ્વરૂપમાં શેર ધરાવે છે અને જેમના શેર IEPF માં ટ્રાન્સફર કરવા માટે જવાબદાર છે, તેઓ નોંધ કરી શકે છે કે કંપની આ હેતુ માટે તેમના દ્વારા રાખવામાં આવેલા અસલ શેર પ્રમાણપત્રોને બદલે નવા શેર પ્રમાણપત્રો જારી કરશે આ સાથે જ નિયમો અનુસાર અસલ શેર પ્રમાણપત્ર(ઓ) રદ થચેલ અને બિન-વાટાઘાટ પાત્ર માનવામાં આવશે.	ચ.નં. કામની વિગત ૧ સમિતિની શાળાઓની માહિતી તથા સમિતિમાં થતા કાર્યક્રમો તથા સરકારશ્રી દ્રારા આપવામાં આવતી માહિતીઓની તથા સમિતિના અધ્યક્ષશ્રી અને ઉપાધ્યક્ષશ્રી ના એકાઉન્ટ સોશ્યલ	અંદાજીત રકમ 3% અર્નેસ્ટમની રૂ.૫,૦૦,૦૦૦/- રૂ.૧૫,૦૦૦/-	૫. નગરપાલિક। બ્રારા Zero Waste Event અંગેની SOP/માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. જેનો ઉપયોગ નગરપાલિકા વિસ્તારમાં રહેનાર દરેક નાગરિક માર્ગદર્શિકાનો ઉપયોગ કરી 50-100 અથવા તેનાથી વધારે પબ્લિક functionમાં SOPમાં દર્શાવ્યા મુજબ इंકશનને zero waste event તરીકે કરવા સૂચન કરવામાં આવે છે. સ્પાછ સ્પર્ધાણ (Nudge indicators)   5. • નગરપાલિકા વિસ્તારમાં સ્થાનિક અથવા અન્ય પ્રાઇવેટ એજન્સીઓ બ્રારા The Prohibition of Employment as Manual							
જો શેરધારકોને વિષય અને નિયમે અંગે કોઈ પ્રશ્નો હોય, તો તેઓ કંપનીના રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ (RTA) ખાતે સંપર્ક કરી શકે છે. M/s. MCS શેર ટ્રાન્સફર એજન્ટ લિ., પહેલો માળ, નીલમ એપાર્ટમેન્ટ, ૮૮, સંપતરાવ કોલોની, છપ્પનભોગ મીઠાઈની ઉપર, અલકાપુરી, વડોદરા–૩૯૦૦૦૭, ટેલિફોન નંબર (૦૨૬૫) ૨૩૧૪७૫७/૨૩૫૦૪૯૦, ઈ–મેલ : mcsltdbaroda@gmail.com.	મિડીચા,કેસબુક,ટવીટર,ઇન્સ્ટાગ્રામ,યુ ટ્યુબ વગેરે ઉપર પ્રચાર પ્રસાર કરવા અંગેની કામગીરી માટે નો વાર્ષિક ઇજારો ( A.M.C.) ટેન્ડર ફ્રોમ માં જણાવેલ સ્પેશીફીકેશન મુજ્બ .		તમામ પ્રકારની ગટર લાઈનની manually સાફ-સફાઈ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. Ban on Manual hazardous entry (without safety gear) • નગરપાલિકા વિસ્તારમાં સ્થાનિક તથા અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા ટ્રીટમેન્ટ							
(એડર) ( ઇર પેઇપર) ( ઇપઇપર), ઇ પેરા માહકાલદેઘા ઇવ્લહુગાલા.છામાં ભૌતિક સ્વરૂપમાં શેર ધરાવતા શેરધારકો માટે મહત્વપૂર્ણ નોંધ : ૧) કૃપા કરીને તમારી KYC વિગતો (પાન, આધાર વગેરે) અને બેંકની વિગતો, જો પહેલાથી નોંધાચેલ ના હોચ અથવા તેમાં સુધારા કરવાના હોચ તો કંપનીના RTA ને લખીને જાણ કરો.	ર સમિતિની શાળાઓના ધો. ૧- ૩ અને ધો.ક માટેના વિદ્યાર્થીઓ ના આઇકાર્ડ લેમીનેશન વાળા તમામ આઇ-કાર્ડ દોરી સાથેના અત્રેના સેમ્પલ મુજ્બના ( ટેન્ડર ફોર્મ સાથે સેમ્પલ રજુ કરવા.)	<u></u> ३.५,००,०००/- 	કર્યા વગરના faecal sludge ને ખુક્ષામાં નિકાલ કરતાં વ્યકિત/desludging ઓપરેટરને ૧૦,૦૦૦/- રૂ. દંડ કરવામાં આવશે. 01 જાન્યુઆરી 2021 પછી બાંધવામાં આવેલી તમામ સેપ્ટિક ટેન્ક IS 2470 (ભાગો 1 અને 2) મુજબ હોવી જોઇએ. • desludging સેવાઓ માટે વપરાશકર્તા માટે નગરપાલિકા ક્રમારા શુલ્ક							
૨) કૃપા કરીને ભૌતિક સ્વરૂપમાં રાખવામાં આવેલા તમારા શેરને ડીમટીરિથલાઈઝ કરો. <b>મુંજાલ ઓટો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ માટે</b> એસડી/–	આ અંગેની વિગતવાર માહિતિ કચેરીના નોટીસબોર્ડ ઉપર મુક તેનો સ્વીકાર કરવાનો કે ૨૯ કરવાનો નિર્ણય સમિતિનો રઢેશે. જે અંગે કે નથી.									
ગૌરી વાચ બાપટ સ્થળ : વાઘોડિયા, વડોદરા કંપની સેક્રેટરી તારીખ : ઓગસ્ટ ૨૨, ૨૦૨૪ એ.સી.એસ. ૨૨७૮૨		સરૂઇ- અવાચ્ચ શાસનાધિકારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,વડોદરા	ચીફ ઓફિસર (માહિતી/નર્મદા/૧૯૮/૨૦૨૪-૨૫) રાજપીપલા નગરપાલિકા							

L O K S A T